

અગત્યની સુચના

જેલ ખાતાના સિપાઈ (પુરૂષ અને મહિલા) સંવર્ગના ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણીના પ્રથમ તબક્કામાં ડીસ્કવોલીફાઈડ થયેલ ઉમેદવારોને કારણે ફેરફાર થયેલ પ્રોવિઝનલ મેરીટ યાદીઓ મુજબ આખરી પસંદગી યાદી અને પ્રતિક્ષા યાદીઓ તૈયાર કરવાના હેતુસર આ યાદીઓમાં સમાવેશ કરવા પાત્ર ઉમેદવારોની યાદી તેમજ પ્રમાણપત્રોની ચકાસણી માટે અગાઉ પ્રથમ તબક્કામાં બોલાવેલ ઉમેદવારો પૈકી ગેરફાજર રહેલ ઉમેદવારોની યાદી આ વેબસાઈટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. સંબંધિત ઉમેદવારોએ નીચેની સુચનાઓ ધ્યાને લેવા જણાવવામાં આવે છે.

- (૧) આ વેબસાઈટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ યાદીઓ ઉમેદવારોના અસલ પ્રમાણપત્રની ચકાસણીના કાર્યક્રમ માટે ઉપસ્થિત રહેવા મૂકવામાં આવેલ છે.
- (૨) પ્રમાણપત્રોની ચકાસણી બાદ ભરતીબોર્ડ દ્વારા આખરી પસંદગી/ પ્રતિક્ષા યાદી હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે. જેની ઉમેદવારોને નોંધ લેવા જણાવવામાં આવે છે.
- (૩) આ યાદી મુજબના ઉમેદવારોને જ તેઓએ ઓનલાઈન કરેલ અરજીમાં દર્શાવેલ વિગતોની ખરાઈ માટે અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે તા.૧૯/૧૨/૨૦૧૩ ના રોજ બોલાવવામાં આવેલ છે. જે અંગેના પત્રો ઉમેદવારે ઓનલાઈન અરજીમાં દર્શાવેલ સરનામે પોસ્ટ કરવામાં આવેલ છે. તે મુજબ ઉમેદવારે અધિક પોલીસ મહાનિદેશક અને જેલોના ઈન્સ્પેક્ટર જનરલની કચેરી, જેલભવન, સુભાષબ્રિજ સર્કલ પાસે, કેશવનગર, અમદાવાદ - ૩૮૦૦૨૭ ખાતે પ્રમાણપત્રોની ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો અને તેની પ્રમાણિત નકલો સહિત અચૂકપણે રૂબરૂ ઉપસ્થિત થવાનું રહેશે.
- (૪) યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારો પૈકી કોઈ ઉમેદવારને પોસ્ટ દ્વારા પત્ર ન મળેલ હોય તો આવા ઉમેદવારોએ પણ તા.૧૯/૧૨/૨૦૧૩ ના રોજ રૂબરૂ આવી પ્રમાણપત્રોની ચકાસણી કરાવી લેવા જણાવવામાં આવે છે.
- (૫) આ વેબસાઈટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ પ્રોવિઝનલ મેરીટ યાદીઓ ફક્ત ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરેલ વિગતોની ખરાઈ માટે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાના તેમજ આખરી પસંદગી યાદી અને પ્રતિક્ષા યાદી તૈયાર કરવાના હેતુ માટે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જેથી કોઈપણ ઉમેદવારે પોતાને પ્રસિદ્ધ કરેલ આ યાદીઓથી સદર સંવર્ગમાં પસંદગી મળેલ છે. તેમ માનવાને રહેશે નહિ.
- (૬) પ્રમાણપત્રોની ચકાસણી માટે અગાઉ પ્રથમ તબક્કામાં બોલાવેલ ઉમેદવારો પૈકી ગેરફાજર રહેલ ઉમેદવારોને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેની અંતિમ તક આપવામાં આવે છે અને આવા ઉમેદવારોએ પણ તા.૧૯/૧૨/૨૦૧૩ના રોજ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવા રૂબરૂ ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.
- (૭) પ્રમાણપત્રો ચકાસણી માટે આ અંતિમ તબક્કો હોય, ગેરફાજર રહેનાર ઉમેદવારને આખરી પસંદગી યાદીમાંથી કમી કરવામાં આવશે. જેની ઉમેદવારોને નોંધ લેવા જણાવવામાં આવે છે.
- (૮) ચકાસણી અર્થે રજૂ કરવાના અસલ પ્રમાણપત્ર
 - (૧) ધોરણ - ૧૨ અથવા તેની સમકક્ષ પરીક્ષાની અસલ માર્કશીટ
 - (૨) શાળા છોડ્યા અંગેનું (લીવીંગ સર્ટીફિકેટ) અસલ પ્રમાણપત્ર
 - (૩) જાતિ અંગેનું અસલ પ્રમાણપત્ર (ST, SC, SEBC કેટેગરીના ઉમેદવારો માટે)
 - (૪) ઉન્નત વર્ગમાં સમાવેશ ન થતો હોવાનું વર્ષ ૨૦૧૨-૧૩ની વાર્ષિક આવકના આધારે માર્ચ-૨૦૧૩ પછી સક્ષમ અધિકારી દ્વારા ઈસ્યુ થયેલ નોન કિમીલેયર અસલ સર્ટીફિકેટ (SEBC કેટેગરીના ઉમેદવારો માટે)
 - (૫) એન.સી.સી. "સી" સર્ટીફિકેટ અસલ (તા.૧૦-૧૦-૨૦૧૨ પુરૂષ ઉમેદવારો માટે અને તા.૨૦-૧૦-૨૦૧૨ મહિલા ઉમેદવારો માટે કે તે પહેલા મેળવેલ), જો મેળવેલ હોય તો
 - (૬) રક્ષાશક્તિ યુનિવર્સિટીમાંથી ડીગ્રી/ડીપ્લોમા અભ્યાસનું (તા.૧૦-૧૦-૨૦૧૨ પુરૂષ ઉમેદવારો માટે અને તા.૨૦-૧૦-૨૦૧૨ મહિલા ઉમેદવારો માટે કે તે પહેલા મેળવેલ) મેળવેલ વર્ગ દર્શાવતું અસલ સર્ટીફિકેટ, જો મેળવેલ હોય તો.